

Ayambil Oli Day 9 - Samyag Tapa Pad Vidhi

નવમો દિવસ - તપ પદ

જાપ: ૐ હ્રીં નમો તવસ્સની વીસ માળા

રંગ: સફેદ
અનાજ: ચોખા
કાઉસગ્ગા: 50
લોગસ્સ
ખમાસણા: 50
પ્રદક્ષિણા: 50
સ્વસ્તિક: 50



ખમાસમણાનો દુહો

ઇચ્છારોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે;
તપ તે એહીજ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે.
વીર જિણેસર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઇ રે;
આતમધ્યાને આતમા, રિક્કિ મળે સવિ આઇ રે.

શ્રી તપ પદના પચાસ ગુણ

- | | | |
|-------------------------------|------------------------------|---------------------------------|
| 1. યાવત્કથિકતપસે નમઃ | 18. તપઃપ્રાયઃિત્તપસે નમઃ | 35. ઝ્લાનસાધુવૈયાવૃત્યતપસે નમઃ |
| 2. ઇત્વરકથિકતપસે નમઃ | 19. છેદપ્રાયઃિત્તપસે નમઃ | 36. શ્રમણોપાસકવૈયાવૃત્યતપસે નમઃ |
| 3. બાહ્ય-ઔનોદર્યતપસે નમઃ | 20. મૂલપ્રાયઃિત્તપસે નમઃ | 37. સંઘવૈયાવૃત્યતપસે નમઃ |
| 4. અભ્યન્તર - ઔનોદર્યતપસે નમઃ | 21. અનવસ્થિતપ્રાયઃિત્તપસેનમઃ | 38. કુલવૈયાવૃત્યતપસે નમઃ |

- | | | |
|--|----------------------------------|--------------------------------|
| 5. દ્રવ્યતઃ વૃત્તિસંક્ષેપતપસે નમઃ | 22. પારાંચિતપ્રાયર્ચિત્તતપસે નમઃ | 39. ગણવૈયાવૃત્યતપસે નમઃ |
| 6. ક્ષેત્રતઃ વૃત્તિસંક્ષેપતપસે નમઃ | 23. જ્ઞાનવિનયરૂપતપસે નમઃ | 40. વાચનાતપસે નમઃ |
| 7. કાલતઃ વૃત્તિસંક્ષેપતપસે નમઃ | 24. દર્શનવિનયરૂપતપસે નમઃ | 41. પૃચ્છનાતપસે નમઃ |
| 8. ભાવતઃ વૃત્તિસંક્ષેપતપસે નમઃ | 25. ચારિત્રવિનયરૂપતપસે નમઃ | 42. પરાવર્તનાતપસે નમઃ |
| 9. કાયક્લેશતપસે નમઃ | 26. મનોવિનયરૂપતપસે નમઃ | 43. અનુપ્રેક્ષાતપસે નમઃ |
| 10. રસત્યાગતપસે નમઃ | 27. વચનવિનયરૂપતપસે નમઃ | 44. ધર્મકથાતપસે નમઃ |
| 11. ઇન્દ્રિય-કષાય- યોગવિષયકસંલીનતાતપસે નમઃ | 28. કાયવિનયરૂપતપસે નમઃ | 45. આર્તધ્યાનનિવૃત્તિતપસે નમઃ |
| 12. સ્નાન-પશુ- પણ્ડગાદિવર્જિતસ્થાનાવસ્થિતતપસે નમઃ | 29. ઉપચારવિનયરૂપતપસે નમઃ | 46. રૌદ્રધ્યાનનિવૃત્તિતપસે નમઃ |
| 13. આલોચનાપ્રાયર્ચિત્તતપસે નમઃ | 30. આચાર્યવૈયાવૃત્યતપસે નમઃ | 47. ધર્મધ્યાનચિન્તનતપસે નમઃ |
| 14. પ્રતિક્રમણપ્રાયર્ચિત્તતપસે નમઃ | 31. ઉપાધ્યાયવૈયાવૃત્યતપસે નમઃ | 48. શુક્લધ્યાનચિન્તનતપસે નમઃ |
| 15. મિશ્રપ્રાયર્ચિત્તતપસે નમઃ | 32. સાધુવૈયાવૃત્યતપસે નમઃ | 49. બાહ્યકાયોત્સર્ગતપસે નમઃ |
| 16. વિવેકપ્રાયર્ચિત્તતપસે નમઃ | 33. તપસ્વિવૈયાવૃત્યતપસે નમઃ | 50. અભ્યન્તરકાયોત્સર્ગતપસે નમઃ |
| 17. કાયોત્સર્ગપ્રાયર્ચિત્તતપસે નમઃ | 34. લઘુશિષ્યાદિવૈયાવૃત્યતપસે નમઃ | |

શ્રી તપ પદનું ચૈત્યવંદન

શ્રી ઋષભાદિક તીર્થનાથ, તદ્ભવ શિવ જાણ;
વિહિ અંતેરપિ બાહ્ય મધ્ય, દ્વાદશ પરિમાણ. 1
વસુકર મિત આમોસહી, આદિક લબ્ધિ નિદાન;
ભેદે સમતા યુત ખિણે, દૃગ્ધન કર્મ વિમાન. 2
નવમો શ્રી તપપદ ભલો એ, ઇચ્છારોધ સરૂપ;
વંદનસે નિત હીરધર્મ, દૂર ભવતુ ભવકૂપ. 3

શ્રી તપ પદનું સ્તવન

નિજ ઇચ્છા અવરોધીએ, તેહીજ તપ જિન ભાખ્યું રે;
બાહ્ય અભ્યંતર ભેદથી, દ્વાદશ ભેદે દાખ્યું રે.
અનુપમ તપપદ વંદીએ - એ આંકણી. 1
તદ્ભવમોક્ષગામીપણું, જાણે પણ જિનરાયા રે;

તપ ક્રીધાં અતિ આકરાં, કૃત્સિત કરમ ખપાયાં રે. અ. 2
કરમ નિકાયિત ક્ષય હુવે, તે તપને પરભાવે રે;
લબ્ધિ અઠયાવીશ ઉપજે, અષ્ટ મહાસિદ્ધિ પાવે રે. અ. 3
એહવું તપપદ ધ્યાવતાં, પૂજતાં ચિત્ત ચાહે રે;
અક્ષય ગતિ નિર્મલ લહે, સહુ યોગીંદ સરાહે રે. અ. 4

શ્રી તપ પદનું સ્તુતિ

ઇચ્છારોધન તપ તે ભાખ્યો, આગમો તેહનો સાખીજી,
દ્રવ્ય ભાવસે દ્વાદશ દાખી, જોગસમાધિ રાખીજી;
ચેતન નિજ ગુણ પરિણતિ પેખી, તેહીજ તપગુણ દાખીજી,
લબ્ધિ સકલનો કારણ દેખી, ઇશ્વર શ્રીમુખ ભાખીજી.